

7th November, 2024

To,
BSE Limited
Listing Dept. / Dept. of Corporate Services,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Mumbai - 400 001.

To,
National Stock Exchange of India Limited
Listing Dept., Exchange Plaza, 5th Floor,
Plot No. C/1, G. Block, Bandra-Kurla Complex,
Bandra (E), Mumbai - 400 051.

Security Code: 539301
Security ID : ARVSMART

Symbol: ARVSMART

Dear Sir/Madam,

Sub: Submission of Newspaper Advertisement in respect Notice of EGM and Remote e-Voting.

Ref: Extraordinary General Meeting of the Company to be held on Thursday, 28th November, 2024.

Pursuant to Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith the copies of the newspaper advertisement published on 7th November, 2024 in the Financial Express (In English - All India edition and in Gujarati - Ahmedabad Edition) in respect of Notice of EGM and Remote e-Voting information for your information and records.

You are requested to take note of the same.

Thanking you,

Yours faithfully,
For Arvind SmartSpaces Limited

Prakash Makwana
Company Secretary

Encl.: As above

#DESIGNEDTOINSPIRE

NOTICE OF EXTRAORDINARY GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the Extraordinary General Meeting ("EGM") of the members of Arvind SmartSpaces Limited ("the Company") will be held on Thursday, 28th November, 2024 at 11:00 AM through Video Conferencing/Other Audio Visual Means ("VCOAVM") without the physical presence of members at a common venue in compliance with Circular Nos. 14/2020 dated 8th April, 2020, 17/2020 dated 13th April, 2020, 22/2020 dated 15th June, 2020, 33/2020 dated 28th September, 2020, 39/2020 dated 31st December, 2020, 10/2021 dated 23rd June, 2021, 20/2021 dated 8th October, 2021, 3/2022 dated 5th May, 2022, 11/2022 dated 28th December, 2022, 09/2023 dated 25th September, 2023 and 09/2024 dated 19th September, 2024, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") to transact the business as set forth in the Notice of EGM.

In compliance with the MCA Circulars, the Notice of EGM along with relevant Explanatory Statement and e-voting instructions for remote e-voting and e-voting during EGM has been sent out by electronic mode to those members whose email addresses are registered with the Company Depositories. The Notice of EGM is also available on the website of the Company at www.arvindsmartspace.com, websites of stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively and on the website of NSDL at www.evoting.nsdl.com.

Pursuant to the MCA Circulars, Members whose email ids were not registered with the Company or Depository Participant(s) as on the Cut-off Date are requested to register their e-mail ids by sending an e-mail citing subject line as "ASL-EGM-Registration of e-mail ID" to Registrar and Transfer Agent of the Company, i.e. Link Intime India Private Limited at ahmedabad@linkintime.co.in or to the Company at investor@arvindinfra.com with name of registered shareholder(s), folio number(s) DP ID/Client ID and No. of equity shares held from the email address they wish to register to enable them to exercise their vote in special business as set out in the Notice of EGM through remote e-voting and e-voting during the EGM, provided by NSDL. For details of the manner of casting voting through remote e-voting and e-voting during EGM by the members holding shares in physical form or who have not registered their email address with the Company or Depository Participant(s), members are requested to refer instruction No. 12 of the Notice of EGM.

In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended by the Companies (Management and Administration) Amendment Rules, 2015, Secretarial Standards - 2 issued by the Institute of Company Secretaries of India on General Meetings and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing remote e-voting facility as well as e-voting during EGM to all the members to cast their vote electronically on all the resolutions as set forth in the Notice of EGM. The Company has engaged the services of National Securities Depository Limited ("NSDL") for providing the e-voting facility to the members. The details are required pursuant to the above mentioned provisions are given under:

1	Date of Completion of sending of Notices through e-mail	Wednesday, 06 th November, 2024
2	Date and time of commencement of remote e-voting	Monday, 25 th November, 2024 (09:00 a.m.)
3	Date and time of end of remote e-voting	Wednesday, 27 th November, 2024 (05:00 p.m.)
4	Cut-off date for determining eligibility of members for voting	Thursday, 21 st November, 2024
5	Scrutinizer	Mr. Hitesh Buch, PCS (CP No.8195)

The members may note that: (a) The facility for e-voting during the EGM will be made available to those members who attend the EGM and have not already cast their vote through remote e-voting; (b) The members who have cast their vote by remote e-voting prior to EGM may also attend/participate in the EGM through VCOAVM but shall not be entitled to cast their vote again; (c) The person whose name is entered in the register of members or beneficiary owners maintained by the depositories as on the cut-off date i.e. Thursday, 21st November, 2024 shall be entitled to avail the facility of remote e-voting or e-voting; (d) Any person who acquires shares of the Company and becomes a member of the Company after sending the Notice and holds shares as of the cut-off date, may obtain the log-in and password by sending request at evoting@nsdl.com mentioning their demat account number/ folio number, PAN, name and registered address. The procedure for electronic voting is available in the Notice of EGM. Please refer e-Voting user manual for Shareholders available in the download section at www.evoting.nsdl.com.

In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-Voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call at 1222-4886 7000 or send a request at evoting@nsdl.com or contact NSDL official, Ms. Pallavi Mishra at the above mentioned telephone numbers.

For Arvind SmartSpaces Limited
Sd/-
Prakash Makwana
Company Secretary

Place: Ahmedabad
Date: 06th November, 2024

CCL PRODUCTS (INDIA) LIMITED

Registered Office : Duggirala, Guntur District, Andhra Pradesh - 522 330.

CIN No: L1510AP1961PLG000674

Extract of Unaudited Consolidated Financial Results for the Quarter Ended 30.09.2024

Particulars	Consolidated			
	Quarter ended	Quarter ended	Quarter ended	Year ended
	30.09.2024	30.06.2024	30.09.2023	31.03.2024
Total income from Operations	73,874.16	77,482.74	60,029.77	2,68,019.68
Net Profit (before Tax, Exceptional and Extraordinary items)	8,730.77	8,718.38	8,970.02	27,623.77
Net Profit before tax (after Exceptional and Extraordinary items)	8,730.77	8,718.38	8,970.02	27,623.77
Net Profit after tax (after Exceptional and Extraordinary items)	7,385.39	7,147.02	6,085.86	25,007.77
Total Comprehensive Income (Comprising Profit after tax and Other Comprehensive Income (after tax))	9,745.23	6,076.75	6,248.42	23,545.35
Paid up Equity Share Capital (₹ 2/- Per Equity Share)	2,863.34	2,863.03	2,660.56	2,660.56
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet)	-	-	-	1,64,720.68
Earnings Per Share (of ₹ 2/- each) (Not Annualised):				
a) Basic	5.55	5.37	4.57	18.80
b) Diluted	5.54	5.36	4.57	18.76

1) The above Financial Results as recommended by the Audit Committee were considered and approved by the Board of Directors at their meeting held on 5th November, 2024.

2) Key data relating to Standalone Financial Results of CCL Products (India) Limited is as under:

Particulars	Quarter ended	Quarter ended	Quarter ended	Year ended
	30.09.2024	30.06.2024	30.09.2023	31.03.2024
	Unaudited	Unaudited	Unaudited	Audited
Total income from operations (₹ in Lakhs)	73,874.16	77,482.74	60,029.77	2,68,019.68
Profit before tax (₹ in Lakhs)	4,075.12	4,195.04	3,945.85	12,017.00
Profit after tax (₹ in Lakhs)	2,762.48	2,514.20	3,116.10	9,530.62
Total comprehensive income after tax (₹ in Lakhs)	2,762.48	2,514.20	3,106.06	9,445.16

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchange under Regulations 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on company's website at www.cclproducts.com and the stock exchanges' websites, www.nseindia.com and www.bseindia.com.

By and on behalf of the Board
Sd/-
Challa Rajendra Prasad
Executive Chairman

Place: Hyderabad
Date: 05-11-2024

Welspun INVESTMENTS & COMMERCIALS LIMITED

Regd. Office : Welspun House, 7th Floor, Kamata City, Sarajal Road, Lower Phase, Warrington - 400013.

Corporate Office : Welspun House, 7th Floor, Kamata City, Sarajal Road, Lower Phase, Warrington - 400013.

Website : www.welspuninvestments.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER AND HALF YEAR ENDED 30 SEPTEMBER 2024 (₹ in Lakhs)

Sr. No.	Particulars	Quarter Ended		Half Year Ended		Year Ended
		30/09/2024	30/06/2024	30/09/2023	30/09/2024	
1	Total Income from Operations (net)	489.75	11.02	386.40	500.77	388.21
2	Net Profit/(Loss) for the period (before Tax and Exceptional Items)	482.67	3.52	379.17	486.19	372.82
3	Net Profit/(Loss) for the period before tax (after Exceptional Items)	482.67	3.52	379.17	486.19	372.82
4	Net Profit/(Loss) for the period after tax (after Exceptional Items)	361.30	2.32	285.65	363.62	279.22
5	Total Comprehensive Income for the period (Comprising profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	16,101.00	7,567.60	11,596.13	24,058.60	18,490.10
6	Equity share capital (Face Value ₹ 10 each)	365.45	365.45	365.45	365.45	365.45
7	Reserves (excluding Revaluation Reserves as per balance sheet of previous accounting year)	-	-	-	-	-
8	Earnings per share of ₹ 10 each (for continuing operations)	0.89	0.06	7.82	9.95	7.64
	Basic and diluted EPS (₹)					

Note: 1) The above unaudited financial results of the Company have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 ("the Act") read with Rule 5 of the Companies (Indian Accounting Standards) Rules, 2015 and the Companies (Indian Accounting Standards) Amendment Rules, 2016 and in terms of Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, including relevant circulars issued by SEBI from time to time. The statutory auditors of the Company have carried out audit of the audited financial results of the Company for the period from time to time.

2) The above unaudited financial results have been reviewed by the Audit Committee in its meeting held on 08th November, 2024 and taken on record by the Board of Directors of the Company in the Board meeting held on that date.

3) The Company is engaged primarily in the business of investment activities and accordingly, there are no separable reportable segments as per Ind AS 108 - Operating Segments. The Company operates as a single geographical segment i.e. domestic.

4) The Company is a Core Investment Company (CIC) which is categorised as non-deposit taking Core Investment Company and not required to register with Reserve Bank of India (RBI) as per the provisions of Master Direction - Core Investment Companies (Reserve Bank) Directions, 2016. Accordingly, the Company has prepared and presented its financial results as prescribed by Schedule III Division III of the Companies Act, 2013.

5) Previous period figures have been regrouped/reclassified, wherever necessary, to correspond with those of current period.

6) As on September 30, 2024, the Company does not have any subsidiary/associate/joint venture company(ies) and hence the preparation of Consolidated Financial Statement is not applicable to the Company.

7) The Company is an extract of the detailed format of unaudited financial results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the unaudited financial results is available on the websites of the Stock Exchanges (www.nseindia.com and www.bseindia.com) and the Company's websites (www.welspuninvestments.com).

For Welspun Investments and Commercials Limited
Sd/-
Gajendra Nahar
Whole Time Director, CFO, CEO
DIN: 02842999

Place: Mumbai
Date: 06 November 2024

neuland NEULAND LABORATORIES LIMITED

Regd. Office: 11th Floor (5th Office Level), Phoenix IVY Building, Plot No. 573A-III, Road No. 82, Jubilee Hills, Hyderabad - 500033

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR ENDED SEPTEMBER 30, 2024

(Amount in lakhs of ₹, unless otherwise stated)

Sl. No.	Particulars	Quarter Ended	Quarter Ended	Quarter Ended	Half Year Ended	Half Year Ended	Year Ended
		30.09.2024	30.06.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total Income	31,517.62	44,440.87	42,079.64	75,958.49	78,582.92	157,112.48
2	Net profit for the period/year before tax	4,942.26	12,984.20	12,159.40	17,926.46	20,475.35	40,143.65
3	Net profit for the period/year after tax	3,284.27	9,787.27	8,924.78	13,071.54	15,112.68	30,007.89
4	Total comprehensive income for the period/year	3,260.44	9,786.51	8,965.06	13,046.95	15,151.53	30,143.82
5	Paid-up Equity Share Capital (Face value: ₹ 10 each)	1,290.05	1,290.05	1,290.05	1,290.05	1,290.05	1,290.05
6	Other equity (excluding revaluation reserves) as shown in the audited balance sheet	-	-	-	-	-	126,896.54
7	Earnings Per Share (of ₹ 10 each) (in absolute ₹ terms)						
	(a) Basic	25.60	76.28	69.56	101.88	117.79	233.89
	(b) Diluted	25.60	76.28	69.56	101.88	117.79	233.89

Note 1: The financial results for the quarter and half year ended September 30, 2024 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on November 06, 2024.

Note 2: Key Standalone Financial Information:

Particulars	Quarter Ended	Quarter Ended	Quarter Ended	Half Year Ended	Half Year Ended	Year Ended
	30.09.2024	30.06.2024	30.09.2023	30.09.2024	30.09.2023	31.03.2024
	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
Total Income	31,517.62	44,440.87	42,079.64	75,958.48	78,582.92	157,112.48
Net profit for the period/year before tax	4,853.83	13,030.86	12,140.42	17,884.69	20,490.83	40,076.92
Net profit for the period/year after tax	3,195.84	9,833.93	8,906.41	13,029.77	15,128.77	29,959.62

Note 3: The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results are available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.neulandlabs.com.

For and on behalf of the Board of Directors
Sd/-
Dr. D.R. Rao
Executive Chairman
(DIN 00107737)

Place: Hyderabad
Date: November 06, 2024

बामर लॉरी एण्ड कं. लिमिटेड
(भारत सरकार का एक उद्यम)



Balmer Lawrie & Co. Ltd.
(A Government of India Enterprise)

(A Mini Ratna - IPSE)

Regd. Office : 21, Netaji Subhas Road, Kolkata - 700001, Tel. No. - (033) 22255133

email - balvar.k@balmerlawrie.com, Website - www.balmerlawrie.com

CIN: L15492WB1924GO1004835

Extracts of Unaudited Financial Results for the Quarter and Six months ended on September 30, 2024

Sl. No.	Particulars	STANDALONE						CONSOLIDATED					
		Quarter Ending	Preceding	Corresponding 3	Year to date	Year to date	Previous year	Quarter Ending	Preceding	Corresponding 3	Year to date	Year to date	Previous year
		September 30, 2024	Quarter Ending June 30, 2024	Months Ending September 30, 2023	Figures for the Current Period Ending September 30, 2024	Figures for the Previous Period Ending September 30, 2024	Ending March 31, 2024	September 30, 2024	Quarter Ending June 30, 2024	Quarter Ending September 30, 2023	Figures for the Current Period Ending September 30, 2024	Figures for the Previous Period Ending September 30, 2024	Ending March 31, 2024
1	Total Income from Operations	64885.86	64862.31	59841.73	129228.17	119732.60	240416.53	65036.98	65040.04	59622.06	130083.02	120668.48	239025.93
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and Extraordinary items)	6857.55	5783.51	7641.19	12641.06	13385.91	27865.34	6223.35	5560.65	6854.54	11784.00	12233.08	27448.94
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and Extraordinary items)	6857.55	5783.51	7641.19	12641.06	13385.91	27865.34	6223.35	5560.65	6854.54	11784.00	12233.08	27448.94
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and Extraordinary items)	4968.68	4678.45	5538.26	9647.13	10074.03	20347.17	4334.48	4455.59	4751.61	8790.07	8921.20	19930.77
5	Total Comprehensive Income / (Loss) for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	4968.68	4678.45	5538.26	9647.13	10074.03	19922.60	6109.81	6293.48	6253.49	12403.29	11837.77	25306.68
6	Equity Share Capital	37100.38	37100.38	37100.38	37100.38	37100.38	37100.38	37100.38	37100.38	37100.38	37100.38	37100.38	37100.38
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	325021.43	-	-	-	-	-	162787.52
8	Earnings Per Share (of ₹ 10/- each) (For continuing and discontinued operations) (in ₹) (Not annualised)												
	a. Basic:	2.90	2.74	3.24	5.64	5.89	11.90	3.66	3.74	3.74	7.39	7.09	15.30
	b. Diluted:	2.90	2.74	3.24	5.64	5.89	11.90	3.66	3.74	3.74	7.39	7.09	15.30

Note: 1) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in its meetings held on November 05, 2024. As required under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Statutory Auditors have conducted Limited Review of the above financial results for the Quarter and Period ended September 30, 2024.

